



ઘરેલુ અને પારિવારિક હિંસા

ઓસ્ટ્રેલિયામાં ઘરેલુ અને પારિવારિક હિંસા સ્વીકાર્ય નથી.

ઘરેલુ અને પારિવારિક હિંસા આચરવી એ કાનૂની ગુનો છે.

આવો ગુનો કરનાર વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ, તેને જેલની સજા થઈ શકે છે.

જો તમે કે તમારી ઓળખીતી વ્યક્તિ જોખમમાં હોવ તો **000** પર પોલીસને ફોન કરો.

ઓસ્ટ્રેલિયામાં પોલીસ પાસે જવું સલામત છે અને તેમનાં પર વિશ્વાસ કરી શકાય છે.

મફત અને ખાનગી સલાહ (counselling) અને માહિતી માટે 1800RESPECT ને **1800 737 732** પર ફોન કરો.

જો તમારે મફત દુભાષિયા સેવાની જરૂર હોય તો **131 450** પર ફોન કરો.

ઓસ્ટ્રેલિયાની સરકાર (Australian Government) કોઈપણ સંજોગોમાં ઘરેલુ અને પારિવારિક હિંસા ચલાવી લેતી નથી.

ઘરેલુ અને પારિવારિક હિંસામાં જે તે સાથીને બીક બતાવીને અથવા તેમની સલામતી માટે જોખમ ઊભું કરીને તેમને કાબૂમાં રાખવાના હેતુથી કરવામાં આવતાં વર્તન કે અપાતી ધમકીઓનો સમાવેશ થાય છે. ઘરેલુ અને પારિવારિક હિંસામાં નીચેનાં કૃત્યોનો સમાવેશ થઈ શકે છે:

- મારપીટ;
- શ્વાસ રૂંધવો;
- સ્ત્રી કે પુરુષ સાથી કે પરિવારને જરૂરિયાત મુજબનાં પૈસા ન આપવાં;
- સ્ત્રી કે પુરુષ સાથીને મિત્રો અને સગાંસંબંધીઓથી દૂર રાખવું, મળવા ન દેવું;
- સ્ત્રી કે પુરુષ સાથીનું અપમાન કરવું કે સતત ટીકા કરતા રહેવું;
- સાથી સાથે સમાગમ કરવા માટે બળજબરી કરવી; અને
- બાળકોને કે પાલતુ પ્રાણીઓને નુકશાન પહોંચાડવાની ધમકી આપવી.

સ્ત્રીઓને પણ પુરુષો જેવા જ હક છે.

ઓસ્ટ્રેલિયાના કાયદામાં સ્ત્રીઓ અને પુરુષોને સમાન ગણવામાં આવે છે.

દરેક વ્યક્તિને તેમના પરિવારો, મિત્રો અને પ્રિયજનો સાથે હકારાત્મક અને સુરક્ષિત સંબંધો અનુભવવાનો હક છે. હિંસા ક્યારે પણ બરાબર હોતી નથી. કોઈએ તેમની સાથે કરવામાં આવતું ખરાબ વર્તન કે તેમને આપવામાં આવતી ઇજાઓ સહન ન કરવી જોઈએ.

ઓસ્ટ્રેલિયામાં સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ સેવાઓ છે જે મદદ કરી શકે છે.

1800RESPECT એ જાતીય સતામણી, ઘરેલુ અને પારિવારિક હિંસાનો ભોગ બનેલાઓને સલાહ આપતી ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય સ્તરની સેવા છે (Australia's national sexual assault, family and domestic violence counselling service). તે મફત અને ખાનગી સલાહ અને માહિતી, ફોન પર કે ઓનલાઇન આપી શકે છે. સલાહ આપનારાઓ તમારી વાતો સાંભળે, તમારા પ્રશ્નોના જવાબ આપી શકે અને તમારી નજીકના વિસ્તારમાં ઉપલબ્ધ બીજી મદદ કરતી સેવાઓ તરફ તમને દોરી શકે છે.

1800 737 732 પર ફોન કરો અથવા **1800RESPECT** ની વેબસાઇટ www.1800RESPECT.org.au પર જાઓ.

શું તમારે દુભાષિયાની જરૂર છે?

131 450 પર ભાષાંતર અને દુભાષિયા સેવા (**Translating and Interpreting Service**) (ટીસ) માટે ફોન કરો. ટીસમાંથી દુભાષિયો તમને બીજી સેવાઓ સાથે વાતચીત કરવામાં મદદ કરશે, જોકે ટીસ દ્વારા સલાહ (counselling) આપવામાં આવતી નથી. બધા કોલ્સ મફત અને ખાનગી હોય છે.